

અનુસંધાન... પાના પહેલાનું

દિલ્હીમાં બિલ્ડીંગ વૃદ્ધી...

હતું અને રવિવારે બપોરે આશરે 1.30 વાગ્યે જ્યારે તે ધરાશયી થયું ત્યારે તેના બેઝમેન્ટમાં સમારકામ ચાલી રહ્યું હતું. સ્થાનિક લોકોનો ઘાવો છે કે દિવસોથી પડેલા વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ઈમારતનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે અંતે તે ધરાશયી થઈ ગઈ. જીવનના સંદેહો શોધવા માટે 70 જવાનો ધરાવતી NDRFની બે ટીમો અને ચાન દળ તેનાત કરવામાં આવ્યા છે. એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે અંદર ફસાયેલા લોકો થાસ લઈ શકે તે માટે કાટમાળ નીચે ઓક્સિજન સિલિન્ડર મુકવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે ફાયર ફાઈટરો પણ તેનાત કરી દેવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 12 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય માટે એક ખોદકામ કરનાર મશીન પહેલેથી જ તેનાત કરવામાં આવ્યું છે, જ્યારે સ્વેલ્ચ અને ગર્ડર દૂર કરવા માટે બે મશીનરી લાવવામાં આવી રહી છે. સ્થળ પર કામ કરતી ફાયર ટીમોને મદદ કરવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોને પણ તેનાત કરવામાં આવી છે. ભીંડને કાબુમાં લેવા માટે રાયટ કન્ટ્રોલ ટીમોને પણ બોલાવવામાં આવી છે. આ વિસ્તાર મુખ્યત્વે વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરતી પાણીપીણીની દુકાનો અને પીજી એક્રોમોડર્નશયી ભરેલી સાંકડી, ગીચ ગલીઓ માટે જાણીતો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સ્ટ્રક્ચર લગભગ 50 વર્ષ જૂનું હતું. ગીચતા ધરાવતી આ ઈમારતોમાં આવરજવા માટે ખૂબ ઓછી જગ્યા બચે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં

રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ ડેરળ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે અને તેઓ નજીકની કોલેજોમાં અભ્યાસ કરે છે. બચાવ ટીમોએ કાટમાળ હટાવવાનું કામ શરૂ કરતાં સ્થાનિક રહીશો પણ આ પ્રયાસમાં જોડાયા હતા અને પોતાના ખુલ્લા હાથે તથા જે પણ સાધનો મળ્યા તેનાથી નીચે દબાયેલા લોકોને શોધવા લાગ્યા હતા. સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું હતું કે કાટમાળ હેઠળ દબાયેલા લોકોના કોન પછા આવી રહ્યા છે. આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉપરાજ્યપાલ તરજશિલ્પ સિંહ સંખૂ, પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને સાંસદ બાંસુરી સ્વરાજ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ભારત યુરોપના...

અને રશિયામાં બળતર શોધી રહ્યા છે. ચિંતાનો વિષય એ છે કે શું આ પ્રવાહ બળતી રાખી શકાશે કે નહીં. વોટ્કસાના ડેટા દર્શાવે છે કે, ઓગસ્ટમાં ભારતમાં આવતા કૂડ અને કન્ટેન્ટ્સેટરો શિપમેન્ટ સતત બીજા મહિને ઘટીને આશરે ૩૮ લાખ બેરલ પ્રતિદિન થઈ ગયું છે. જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે ૪૮ લાખ બેરલ પ્રતિદિન હતું.

રશિયાની મુલાકાત...

આવ્યું છે. શનિવારે મોસ્કોમાં બંધ બારણે યોજાયેલી બેઠક ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને કોઈ મોટા ઘટનાવિકાસની જાહેરાત વિના સમાપ્ત થઈ હતી. પુતિનના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવે વાટાઘાટોને રચનાત્મક, સ્પષ્ટ અને ઉપયોગી ગણાવી હતી, પરંતુ તેમણે કોઈ ચોક્કસ પરિણામો અંગે ચર્ચા કરી નહોતી. ઉષાકોવે જણાવ્યું હતું કે મોસ્કોએ યુક્રેનમાં યુદ્ધના

મેદાનની સ્થિતિનું “બ્યાપક મૂલ્યાંકન” ઓફર કર્યું હોવા છતાં, આ વાટાઘાટો માત્ર યુક્રેનના યુદ્ધ પર કેન્દ્રિત નહોતી. તેમણે કહ્યું, અધિક મુદ્દાઓ અને રશિયા તથા અમેરિકા માટે સંભવિત મોટા, પરસ્પર ફાયદાકારક સંયુક્ત પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.સ્ટીવ વિટકોકે મંત્રણાને અર્થસભર, અગત્યની અને પ્રોત્સાહક ગણાવી હતી. ઝેલેન્સ્કીએ અમેરિકી દૂતોનો આભાર માન્યો હતો.

ટ્રમ્પની ચીનમાં...

પહેલા, બેઠકનો એજન્ડા શું હશે તે સમજવું મહત્વપૂર્ણ છે. “અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે બેઠકનો મુખ્ય વિષય શું હશે અને તેના પરિણામથી આપણે શું અપેક્ષા રાખી શકીએ છીએ,” તેમણે કહ્યું. આ મહિનાની શરૂઆતમાં, કેમલિનના સહાયક યુરી ઉષાકોવે નવેમ્બરમાં ચીનના રોનગ્ડેનમાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાતની શક્યતા ઓર્કસ્ટ્રા કરી હતી.

બિહારમાં પૂરની...

અસર થવાની સંભાવના છે, તેમ તેમણે જણાવ્યું હતું.રાજ્યની વિવિધ નદીઓની જળસપાટીમાં વધારો થવાને કારણે 11 જિલ્લાઓ - પટના, ભોજપુર, સારણ, વેશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સાર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર અને અરારિયાના ૩૩૦ ગ્રામ પંચાયત વિસ્તારોમાં આશરે 19.૬7 લાખ લોકો પ્રભાવિત થયા છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યમાં અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર પ્રભાવિત લોકો માટે હાલમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 110 સામુદાયિક રસોડા કાર્યરત છે, તેમ તેમણે

ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ, સુરત

ઉમેર્યું હતું કે, પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બહાર કાઢવા અને અવરજવર સુગમ બનાવવા માટે 1,૩45 બોટ તેનાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે ગંગા, યમુના અને શારદા નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી અને સ્થાનિક રહીશોએ પાણી ભરાઈ જવા તેમજ ગટરના પાણીના ભરાવાની ફરિયાદ કરી હતી, જેને પગલે અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

વિશ્વ મેપમાં...

રજૂઆતના મૂળભૂત સિદ્ધાંત પર ભાર મુક્યો હતો. જયસ્વાલ આ મુદ્દે મીડિયાના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ વિષય નકશાને અપનાવતો નથી કે તેને પ્રમાણિત કરતો નથી, અને ન તો તે રાષ્ટ્રીય સરકારે, વિવાદિત વિસ્તારો અથવા સ્થળોના નામો સહિત નકશા નિર્માણને આવરી લે છે.

શેરબજારના નવા નિયમ...

કેશ માર્કેટમાં કલોડિંગ ઓફશન સત્ર (CAS) ની રજૂઆત સાથે પ્રી-ઓપન સત્રને સંરેખિત કરવા માટે રચાયેલ છે. બદલાયેલા નિયમોનો હેતુ રોકડ અને રેરેસિવેટિય સેગમેન્ટ્સ વચ્ચે સુમેળ સુધારવા અને બજારની કામગીરીને સરળ બનાવવાનો પણ છે. આવૃત્તીકાલ સોમવારથી શરૂ થનારા 1૫ મિનિટના પ્રી-ઓપન સત્રને વિવિધ તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. જેમાં પહેલો તબક્કો સવારે ૯:૦૦ થી ૯:૦૫ સુધીનો રહેશે. રોકાણકારો મર્યાદા અને બજાર બંને ઓફર આપી શકશે, તેમાં ફેરફાર કરી શકશે અથવા રદ કરી શકશે. તે પછી બીજો તબક્કો સવારે ૯:૦૫ થી ૯:૧૦

સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન ફક્ત મર્યાદા ઓફર જ મૂકી શકાશે, તેમાં ફેરફાર કરી શકાશે અથવા રદ કરી શકાશે. ઓફર-મેચિંગ અને ટ્રેડ-કન્ફર્મશન સત્ર હવે સવારે ૯:૧૦ થી ૯:૧૨ સુધી ચાલશે. આ અગાઉના ૯:૦૮ થી ૯:૧૨ ના સમયગાળાને બદલે છે. આ સત્ર દરમિયાન, શરૂઆતનો ભાવ નક્કી કરવામાં આવશે, ઓફર મેચ કરવામાં આવશે અને ટ્રેડ્સ કન્ફર્મ કરવામાં આવશે. આ પછી સવારે ૯:૧૨ થી ૯:૧૫ સુધીનો બફર સમયગાળો રહેશે. આનાથી પ્રી-ઓપન સત્રથી નિયમિત સતત ટ્રેડિંગમાં સરળ સંક્રમણ થશે.

ABVP દ્વારા MCD...

બેરેટર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન MCD ઓફિસમાં પણ ટોડફોડ કરવામાં આવી હતી. વિરોધીઓ સત્વ નિકેતન ઘટના માટે જવાબદારી અને MCD કમિશનરના સહનુભામી માંગ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે આ સમગ્ર હંગામા પર જણાવ્યું હતું કે, આજની ઘટનાનો વિરોધ કરવા માટે લગભગ 150-200 ABVP સભ્યો સિવિલ સેન્ટરમાં એકઠા થયા હતા. સુશોચ્યાર ક્લીને અમસીડીનો વિરોધ કર્યો. વ્યારનાદ, કેટલાક વિરોધીઓએ સિવિલ સેન્ટરની પ્રાચલ ધમારતમાં બળબળરીથી પ્રવેશવાનો મુચ્ચાસ કર્યો, જેના કારણે પોલીસ અધિકારીઓ સાથે ગપગપી થઈ. લગભગ 15 વિદ્યાર્થીઓની સત્કાવત થઈ હતી

કાટમાળ નીચે ફસાયેલા...

સામે આવી છે કે કાટમાળ નીચે અટવાયેલા કેટલાક વિદ્યાર્થીઓ પોતાના મોળાઇલ ફોન દ્વારા અંદરથી મદદ માટે કોલ કરી રહ્યા છે.ઘટનાસ્થળે પહોંચેલા ભાવપના ધારાસભ્ય અનિલ શર્માએ

જણાવ્યું હતું કે, અમને અંદર ફસાયેલા લોકો તરફથી ફોન આવી રહ્યા છે.

ધમારનું રિનોવેશન...

કાર્ડ અને ધમારત માલિકો અને નાગરિક એવન્સીઓની “ઉદારીનાતા” ની ફરિયાદ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા છે દિવસથી અવિરત વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ વધુ અસાધ્ય થઈ ગઈ છે, અને ધમારતના બેઝમેન્ટમાં સમારકામ ચાલી રહ્યું છે.

સાદામી ધમારતો જર્જરિત...

નથી. રહેવાસીઓએ ઘાવો કર્યો હતો કે એમસીડી ઓફિસ ઘરાશાયી થયેલી ધમારતની બાજુમાં જ આવેલી છે. તેમણે કહ્યું કે ઘરાશાયી થયેલી ધમારતની પાછળની શેરીમાં નિર્માણાદીન એક ધમારત, જેનો ઉપયોગ છોકરીઓના પીજી તરીકે થવાનો હતો, લગભગ બે વર્ષ પહેલાં વૃદ્ધી પડી હતી અને ત્યારથી તે એ જ સ્થિતિમાં છે.

એક બેડ માટે...

કેરળ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે અને મુખત્વે મોતીલાલ નેહરુ કોલેજ, આદ્યામ રામ સનાતન ધર્મ કોલેજ અને શ્રી વેંકટેશ્વર કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓ પ્રતિ બેડ આશરે રૂ. 12,000 ભાડું સુકવતા હતા.” બે દાયકાથી વધુ સમયથી આ વિસ્તારમાં રહેતા બ્રિંગ્કાએ જણાવ્યું, “અહીં ધમારતો પાંચ-છ માળ સુધી બનાવી દેવામાં આવે છે. ઘણા ઘરોને બોયટ પીછમાં ફેરવી દેવાયા છે અને માલિકો બીજે ક્યાંક શિકુટ થઈ ગયા છે. તેઓ માત્ર પ્રોપર્ટીનું નામ પીજી રાખી દે છે, ઓનલાઇન ભાડું વસૂલે છે અને પાછા આવીને બેવાની પણ તકલીફ લીધા વગર જતા રહે છે.”

‘મિર્ઝાપુર ધ મુવી’: સરસ મનોરંજક ફિલ્મ



પહોંચાડા વગર ડ્રામા, એક્શન, લુમર અને ઈમોશન વચ્ચે યોગ્ય સંતુલન બનાવીને સામગ્રીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સંભાળી છે. હા, બીજા ભાગની શરૂઆતમાં ફિલ્મ થોડી ધીમી પડે છે... પરંતુ, સદનસીબે, જેસલમેરના અદ્ભુત રેતીના દુવાઓ વચ્ચે શુટ કરાયેલું પ્રી-ક્લાઈમેક્સથી ક્લાઈમેક્સ સુધીનું દ્રશ્ય તમને સાચે જ મંત્રમુગ્ધ કરી દે છે.

...continued from previous page.

#

ASBA

Simple, Safe, Smart way of Application!!!!

Applications supported by blocked amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, For further details, check section on ASBA.

Mandatory in public issues. No cheque will be accepted.

UPI

UNITED PAYMENTS INTERFACE

UPI-Now available in ASBA for Retail Individual Investors and Non - Institutional Investor applying for amount upto ₹ 5,00,000/-, applying through Registered Brokers, DP's and RTAs. UPI Bidder also have the option to submit the application directly to the ASBA Bank (SCSBs) or to use the facility of linked online trading, demat and bank account. Investors are required to ensure that the bank account used for bidding is linked to their PAN. Bidders must ensure that their PAN is linked with Aadhaar and are in compliance with CBDT notification dated February 13, 2020, issued by the Central Board of Direct Taxes and the subsequent press releases, including press releases dated June 23, 2021 and September 17, 2021 and CBDT circular no.7 of 2022, dated March 30, 2022 read with press release dated March 28, 2023 and any subsequent press releases in this regard.

ASBA has to be availed by all the investors except anchor investors. UPI may be availed by (i) Retail Individual Investors in the Retail Portion; (ii) Non-Institutional Investors with an application size of up to ₹ 500,000 in the Non-Institutional Portion. For details on the ASBA and UPI process, please refer to the details given in ASBA form and abridged prospectus and also please refer to the section “Offer Procedure” on page 596 of the RHP. The process is also available on the website of Association of Investment Bankers of India (“AIBI”) and Stock Exchanges and in the General Information Document. ASBA bid-cum-application forms can be downloaded from the websites of the Stock Exchanges and can be obtained from the list of banks that is displayed on the website of SEBI at www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpI=yes&intImlId=35 and <https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpI=yes&intImlId=43>, respectively as updated from time to time to time. For the list of UPI apps and banks live on IPO, please refer to the link: www.sebi.gov.in. UPI Bidders Bidding using the UPI Mechanism may apply through the SCSBs and mobile applications whose names appear on the website of SEBI, as updated from time to time. (ICICI Bank Limited and HDFC Bank Limited have been appointed as Sponsor Banks for the Offer, in accordance with the requirements of the SEBI Circular dated November 1, 2018 as amended. For Offer related queries, please contact the BRLMs on their respective email IDs as mentioned below. For UPI related queries, investors can contact NPCI at the toll free number: 18001201740 and mail Id: ipo.upi@npci.org.in.

An indicative timetable in respect of the Offer is set out below:

Submission of Bids (other than Bids from Anchor Investors):

Bid/Offer Period (except the Bid/Offer Closing Date)	
Submission and Revision in Bids	Only between 10.00 a.m. and 5.00 p.m. (Indian Standard Time (“IST”))
Bid/Offer Closing Date*	
Submission of Electronic Applications (Online ASBA through 3-in-1 accounts) – For RIBs other than QIBs and NIIs	Only between 10.00 a.m. and up to 5.00 p.m. IST
Submission of Electronic Applications (Bank ASBA through Online channels like Internet Banking, Mobile Banking and Syndicate UPI ASBA applications where Bid Amount is up to ₹500,000)	Only between 10.00 a.m. and up to 4.00 p.m. IST
Submission of Electronic Applications (Syndicate Non-Retail, Non-Individual Applications)	Only between 10.00 a.m. and up to 3.00 p.m. IST
Submission of Physical Applications (Bank ASBA)	Only between 10.00 a.m. and up to 1.00 p.m. IST
Submission of Physical Applications (Syndicate Non-Retail, Non-Individual Applications where Bid Amount is more than ₹500,000)	Only between 10.00 a.m. and up to 12.00 p.m. IST
Modification/ Revision/cancellation of Bids	
Upward Revision of Bids by QIBs and Non-Institutional Bidders categories [#]	Only between 10.00 a.m. and up to 4.00 p.m. IST on Bid/ Offer Closing Date
Upward or downward Revision of Bids or cancellation of Bids by RIBs	Only between 10.00 a.m. and up to 4.00 p.m. IST

* UPI mandate end time and date shall be at 05:00 p.m. on Bid/ Offer Closing Date.
QIBs and Non-Institutional Bidders can neither revise their bids downwards nor cancel/withdraw their bids.

THE EQUITY SHARES OF OUR COMPANY WILL GET LISTED ON MAIN BOARD PLATFORM OF BSE AND NSE

In case of any revision to the Price Band, the Bid/Offer Period will be extended by at least three additional Working Days after such revision in the Price Band, subject to the Bid/ Offer Period not exceeding 10 Working Days. In cases of force majeure, banking strike or similar unforeseen circumstances, our Company may, in consultation with the BRLM, for reasons to be recorded in writing, extend the Bid / Offer Period for a minimum of one Working Day, subject to the Bid/ Offer Period not exceeding 10 Working Days. Any revision in the Price Band and the revised Bid/Offer Period, if applicable, will be widely disseminated by notification to the Stock Exchanges, by issuing a public notice, and also by indicating the change on the respective websites of the BRLM and at the terminals of the Syndicate Member and by intimation to the Designated Intermediaries and the Sponsor Banks, as applicable.

This Offer is being made in terms of Rule 19(2)(b) of the SCRR, read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made through the Book Building Process in terms of Regulation 6(1) of the SEBI ICDR Regulations, wherein in terms of Regulation 32(1) of the SEBI ICDR Regulations, not more than 50% of the Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers (“QIBs”, and such portion, the “QIB Portion”) provided that our Company in consultation with the BRLM, may allocate up to 60% of the QIB Portion to Anchor Investors on a discretionary basis in accordance with the SEBI ICDR Regulations (“Anchor Investor Portion”), out of which 33.33% shall be reserved for domestic Mutual Funds and 6.67% for life insurance companies and pension funds, subject to valid Bids being received from domestic Mutual Funds, life insurance companies and pension funds at or above the Anchor Investor Allocation Price, in accordance with the SEBI ICDR Regulations. In the event of under-subscription or non-allocation in the Anchor Investor Portion, the balance Equity Shares of face value of ₹ 2 each shall be added to the Net QIB Portion. Further, 5% of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis only to Mutual Funds and the remainder of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis to all QIB Bidders (other than Anchor Investors) including Mutual Funds, subject to valid Bids being received at or above the Offer Price. However, if the aggregate demand from Mutual Funds is less than 5% of the Net QIB Portion, the balance Equity Shares of face value of ₹ 2 each available for allocation in the Mutual Fund Portion will be added to the remaining QIB Portion for proportionate allocation to QIBs. Further, not less than 15% of the Offer shall be available for allocation to Non-Institutional Bidders (“Non-Institutional Portion”) out of which (a) one-third of such portion shall be reserved for applicants with application size of more than ₹200,000 and up to ₹1,000,000; and (b) two-third of such portion shall be reserved for applicants with application size of more than ₹1,000,000 provided that the unsubscribed portion in either of such sub-categories may be allocated to applicants in the other sub-category of Non-Institutional Bidders and not less than 35% of the Offer shall be available for allocation to Retail Individual Bidders (“RIBs”) in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received from them at or above the Offer Price.

Bidders/ Applicants should ensure that DP ID, PAN, Client ID and UPI ID (for UPI Bidders bidding through the UPI Mechanism) are correctly filled in the Bid cum Application Form. The DP ID, PAN and Client ID provided in the Bid cum Application Form should match with the DP ID, PAN, Client ID available in the Depository database, otherwise, the Bid cum Application Form is liable to be rejected. Bidders/ Applicants should ensure that the beneficiary account provided in the Bid cum Application Form is active. Bidders/Applicants should note that on the basis of the PAN, DP ID, Client ID and UPI ID (for UPI Bidders bidding through the UPI Mechanism) as provided in the Bid cum Application Form, the Bidder/Applicant may be deemed to have authorised the Depositories to provide to the Registrar to the Offer, any requested Demographic Details of the Bidder/Applicant as available on the records of the depositories. These Demographic Details may be used, among other things, for giving Allotment Advice or unblocking of ASBA Account or for other correspondence(s) related to the Offer. Bidders/Applicants are advised to update any changes to their Demographic Details as available in the records of the Depository Participant to ensure accuracy of records. Any delay resulting from failure to update the Demographic Details would be at the Bidders’/Applicants’ sole risk. Investors must ensure that their PAN is linked with Aadhaar and are in compliance with CBDT notification dated February 13, 2020 and press release dated June 25, 2021, read with press release dated September 17, 2021

BOOK RUNNING LEAD MANAGER	REGISTRAR TO THE OFFER	COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
 Equirus Capital Limited (formerly known as Equirus Capital Private Limited) Unit No. 2601B, 26th Floor, A Wing, Marathon Futurex, Mafatal Mills Compound, N M Joshi Marg, Lower Parel, Mumbai - 400 013, Maharashtra, India Telephone: +91 22 4332 0734 Email: steam_ipo@equirus.com Investor Grievance E-Mail: investorgrievance@equirus.com Website: www.equirus.com Contact person: Mrunal Jadhav/Rahul Wadekar SEBI Registration No.: INN0000011286	 KFin Technologies Limited Selenium Tower B, Plot 31 & 32 Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032, Telengana, India Telephone: + 91 40-67162222/ 180030949001 Email: steamhouse.ip@kfintech.com Investor Grievance E-Mail: enward_ris@kfintech.com Website: www.kfintech.com Contact person: M. Murali Krishna SEBI Registration No.: INR0000002221	Shyam Bhadresh Kapadia Office No. – 324, Second Floor, Four Point, V.I.P., Road, Vesu, Surat – 395 007 Gujarat, India Telephone: +91 261 2998109 E-mail: compliance@steamhouse.in Investors may contact our Company Secretary and Compliance Officer, the BRLM or the Registrar to the Offer in case of any pre-Offer or post-Offer related grievances including non-receipt of letters of Allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode, etc. For All offer related queries and for redressal of complaints, Investors may also write to the BRLM.

AVAILABILITY OF THE RHP: Investors are advised to refer to the RHP and the section titled “Risk Factors” on page 21 of the RHP, before applying in the Offer. A copy of the RHP shall be available on website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, the website of the Company at www/steamhouse.in and on the website of the BRLM, i.e., Equirus Capital Limited (formerly known as Equirus Capital Private Limited) at www.equirus.com.

AVAILABILITY OF THE ABRIDGED PROSPECTUS: A copy of the abridged prospectus shall be available on the website of the Company, the BRLM and the Registrar to the Offer at <https://steamhouse.in>, www.equirus.com and www.kfintech.com, respectively.

AVAILABILITY OF BID CUM APPLICATION FORMS: Bid cum Application Forms can be obtained from the Registered and Corporate Office of **STEAMHOUSE INDIA LIMITED**, Telephone: +91 261 2998109; **BRLM : Equirus Capital Limited (formerly known as Equirus Capital Private Limited)**, Telephone: +91 22 4332 0734 and **Syndicate Member:** Equirus Securities Private Limited, Tel: +91 22 4332 0600 and at the select locations of the Sub-syndicate Members, SCSBs, Registered Brokers, RTAs and CDPs participating in the Offer. Bid cum Application Forms will also be available on the websites of BSE and NSE and the Designated Branches of SCSBs, the list of which is available at websites of the Stock Exchanges and SEBI.

Sub-Syndicate Members: Axis Capital Limited, HDFC Securities Limited, IIFL Capital Services Limited, JM Financial Services Limited, Kotak Securities Limited, LKP Securities Limited, Motilal Oswal Financial Services Limited, SBICAP Securities Limited, Sharekhan Limited, SMC Global Securities Limited, and YES Securities (India) Limited.

UPI: UPI Bidders can also Bid through UPI Mechanism.

Escrow Collection Bank and Refund Bank: HDFC Bank Limited

Public Offer Bank : ICICI Bank Limited

All relevant terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

Sponsor Banks : HDFC Bank Limited and ICICI Bank Limited

For **STEAMHOUSE INDIA LIMITED**
On behalf of the Board of Directors

Sd/-

Shyam Bhadresh Kapadia
Company Secretary and Compliance Officer

Place: Surat, Gujarat
Date: September 4, 2026

STEAMHOUSE INDIA LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares (“**Offer**”) defined above and has filed the RHP with the RoC, SEBI and the Stock Exchanges. The RHP is available on the website of the SEBI at www.sebi.gov.in, the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com, respectively, the website of the Company at <https://steamhouse.in>; and on the website of the Book Running Lead Manager (“**BRLM**”), i.e., Equirus Capital Limited (formerly known as Equirus Capital Private Limited) at www.equirus.com. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see “**Risk Factors**” beginning on page 21 of the RHP. Potential investors should not rely on the UDRHP-I filed with SEBI and the Stock Exchanges, and should rely on their own examination of our Company and the Offer and rely on the RHP filed with the RoC in connection with the offer including the risks involved, for making any investment decision.

This public announcement is not an offer of securities for sale in the United States or elsewhere. This public announcement has been prepared for publication in India only and is not for publication or distribution, directly or indirectly, in or into the United States. The Equity Shares offered in the Offer have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (“U.S. Securities Act”), or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold only outside the United States in “offshore transactions” as defined in, and in reliance on, Regulation S under the U.S. Securities Act and applicable laws of the jurisdictions where such offers and sales occur. Any public offering of securities to be made in the United States will be made by means of a prospectus that may be obtained from the issuer or the selling security holder and that will contain detailed information about the company and management, as well as financial statements. No public offering or sale of securities in the United States is contemplated. The Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be issued or sold except in compliance with the applicable laws of such jurisdiction.